


બધી રાશિઓ માટે શનિની સાડાસાતીથી બચવા, પીડાનાશક ઉપાય

From :- [Jagdish Manilal Rajpara](#)



શનિની સાડાસાતી વ્યક્તિના માનસિક કષ્ટોમાં વધારો કરી, વ્યક્તિથી સામાન્યથી વધુ મહેનત કરાવે છે. આ સમયમાં વ્યક્તિએ પોતાના કાર્યોને પૂર્ણ કરવા માટે વારંવાર પ્રયાસ કરવા પડે છે. મહેનત અનુસાર સફળતા ન મળવાને કારણે કેટલીક વાર વ્યક્તિના સ્વભાવમાં નિરાશા ઉદભવે છે.

શનિની સાડાસાતી એક તરફ તો વ્યક્તિને તેના કાર્યક્ષેત્રમાં સફળતા, પ્રગતિ અને નવા માર્ગ ખોલે છે ત્યાં જ બીજી તરફ આ સમયે વ્યક્તિના વ્યક્તિગત જીવન જેમાં પારિવારિક જીવન અને દાંપત્ય જીવન બંનેમાં પેરશાનીઓ સર્જાય છે. શનિની સાડાસાતી વ્યક્તિના ઘૈર્ય અને સંઘર્ષમાં વૃદ્ધિ કરે છે અને વ્યક્તિની સહનશક્તિ પણ પહેલાં કરતાં વધી જાય છે.

સાડાસાતી સમય દરમિયાન સર્જાતી બાધાઓને દૂર કરવા માટે વ્યક્તિએ શનિના કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. તો ચાલો આજે તમને જણાવી દઈએ કે તમારી રાશિ પ્રમાણે તમારે કયા ઉપાય કરવા.

આગળ જાણો શનિની સાડાસાતીથી પીડાતા લોકોએ કયા ઉપાય કરવા.....

• મેષ રાશિ-

- શનિવાર હનુમાન મંદિરમાં પૂજા કરીને પ્રસાદ ધરાવવો.
- શનિગ્રહથી સંબંધિત વસ્તુઓનું 7 શનિવાર સુધી દાન કરવું.
- મહામૃત્યુંજય મંત્રનું દરરોજ એક માળા અથવા તેથી વધુ જાપ કરવું.
- પારદ શિવલિંગના દરરોજ દર્શન કરવા.
- શનિવારે સરસિયાના તેલમાં પોતાનો પડછાયો જોઈને દાન કરવું જોઈએ.
- જટાવાળું નારિયેળ, બદામ અથવા કાળી છત્રીનું દાન કરવું.
- મધ્યમા આંગળીમાં ઘોડાની નાલનો છલ્લો ધારણ કરવો.

• વૃષભ રાશિ-

- લોખંડ અને ચાંદીની વીંટીમાં મધ્યમા આંગળીમાં નીલમ રત્ન ધારણ કરવું.

-શનિ સ્ત્રોતનું જાપ કરવું.

-પીપળા નીચે શનિવારે તેલનો દીવો પ્રગટાવવો.

-શનિવારે રોજિંદી વસ્તુઓના ઉપયોગમાં શનિ ગ્રહ સંબંધિત વસ્તુઓનો વધુ ઉપયોગ કરવો જોઈએ.

- ઘરના મુખ્ય દ્વાર પર અંદરની તરફ ઘોડેની નાલ લગાવવી.

-ઘરમાં પૂજા સ્થાન પર પારદ શિવલિંગ રાખવું અને તેની સામે દરરોજ મહામૃત્યુજંત્ય મંત્રનું જાપ કરવું.

-શનિવારે શનિ ગ્રહથી સંબંધિત વસ્તુઓ ન ખરીદવી.

• મિથુન રાશિ-

-શનિવારે મધ્યમા આંગળીમાં નીલમ અથવા તેનું ઉપરત્ન ફિરોઝા ચાંદીમાં ધારણ કરવું.

-ઘરના દ્વારની પાસે કાળા રંગના પથ્થરની શિલા સ્થાપિત કરવી.

-સ્વસ્તિક અથવા અન્ય માંગલિક ચિન્હ ઘરના મુખ્ય દ્વાર પર લગાવવા.

-કાળા કૂતરાને જાડી રોટલી શનિવારે ખવાડાવી.

-ઘરમાં શનિવારે આસમાની રંગની ચાદરોનો ઉપયોગ કરવો.,

-શનિવારે કાચા સરસિયાનો તેલ કાચી જમીન પર પાડવું.

-સાડાસાતીની અવધિમાં શનિવારે સફેદ વસ્ત્ર ધારણ કરવા નહીં.

• કર્ક રાશિ-

-દરરોજ શનિ સ્ત્રોતનું શ્રદ્ધાપૂર્ણ જાપ કરવું.

-શનિ સંબંધિત વસ્તુઓનું નિયમિત રીતે 7 શનિવાર સુધી દાન કરવું.

-મહામૃત્યુજંત્ય મંત્રનું યથાશક્તિ મુજબ રોજ જાપ કરવું.

-કાળા ઘોડાની નાલને શનિવારે મધ્યમા આંગળીમાં અંગૂઠીમાં ધારણ કરવું.

-શનિદેવના મંદિરે શનિવારે સરસિયા તેલનો દીવો પ્રગટાવવો.

-પ્રત્યેક શનિવારે કેરીના અથાણાં સાથે એક-એક રોટલી 11 ભિખારીઓને દાન કરવી.

-શનિવારે વ્રત કરવો.

• સિંહ રાશિ

-વ્યક્તિએ શનિ ગ્રહના મંત્રનું દરરોજ જાપ કરવું જોઈએ.

-શનિ ગ્રહથી સંબંધિત વસ્તુઓનું નિયમિત રીતે 7 શનિવાર સુધી દાન કરવું.

-આ રાશિના વ્યક્તિએ મધ્યમા આંગળીમાં કાળા ઘોડાની નાલનો છલ્લો ધારણ કરવાથી શનિ કષ્ટ દૂર થાય છે.

-આ રાશિના વ્યક્તિએ 108 શનિ છાયા ચંત્રોને જળમાં પ્રવાહિત કરવા.

-પારદ શિવલિંગ સામે મહામૃત્યુંજય મંત્રનું દરરોજ 108 વાર જાપ કરવું.

• કન્યા રાશિ-

-દરરોજ શનિ ગ્રહના મંત્રનું જાપ કરવું.

-શનિ ગ્રહથી સંબંધિત વસ્તુઓનું 7 શનિવાર સુધી સતત દાન કરવું.

-ઘરમાં ગ્રહ પીડા નિવારક શનિ ચંત્ર લગાવી શનિ સ્ત્રોતનું જાપ કરવું.

-નારિયેળ અથવા બદામને શનિવારે જળમાં પ્રવાહિત કરવું.

-શનિ છાયા ચંત્રનો પ્રયોગ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે

• તુલા રાશિ-

-શનિવારે સાબૂત અડદને કોઈ ભિખારીને દાન કરવું.

-ઘરની બહાર કાળા કૂતરાને રોટલી ખવડાવી.

-શનિ છાયા ચંત્રને જળમાં પ્રવાહિત કરવું.

-નીલમ અથવા તેના ઉપરત્નોને અંગૂઠીને ધારણ કરવું.

-શનિવારે સરસિયાના તેલનું દાન કરવું.

-પારદ શિવલિંગની નિયમિત રૂપથી પૂજા કરવી.

• વૃશ્ચિક રાશિ-

-આ રાશિના વ્યક્તિએ ગ્રહ પીડા નિવારક શનિ ચંત્ર ઘરમાં લગાવી તેની સામે શનિના તાંત્રિક મંત્રનું દરરોજ જાપ કરવું.

-કાળા તલ કીડીઓને ખવડાવવા.

-તાંબાનો સિક્કો વહેતા જળમાં પ્રવાહિત કરવું.

-નારિયેળ તમારા માથેથી ઉતારીને જળમાં પ્રવાહિત કરવું.

-હનુમાનજીની સતત ઉપાસના કરવી.

-પારદના શિવલિંગની સામે મહામૃત્યુંજય મંત્રનું ઓછામાં ઓછું 108 વાર દરરોજ જાપ કરવું.

• ધન રાશિ-

-આ રાશિના વ્યક્તિએ શનિવારે વ્રત રાખવાથી લાભ પ્રાપ્ત થશે.

-સાબૂત અડદનું શનિવારે દાન કરવું.

-108 શનિ છાયા ચંત્રને જળમાં પ્રવાહિત કરવું.

-શિવલિંગની સામે મહામૃત્યુંજય મંત્રનું જાપ એક માળા કરવું.

-શનિવારના દિવસે શનિ ગ્રહથી સંબંધિત વસ્તુઓ ખરીદીને ઘરમાં ન લાવવી.

• મકર રાશિ-

-શનિ ગ્રહ મંત્રનું જાપ દરરોજ કરવું.

-હનુમાનજીની દરરોજ ઉપાસના કરવી.

શનિવારે દારૂ અથવા તામસી પદાર્થોનું સેવન ન કરવું.

-ઘરમાં શનિ ચંત્ર લગાવવું અને તેની સામે શનિ મંત્રનું જાપ કરવું.

-શનિની સાડાસાતી દરમિયાન આ રાશિના વ્યક્તિઓ દરરોજ પીપળના વૃક્ષમાં જળ અર્પણ કરવું.

- કુંભ રાશિ-

- આ રાશિના લોકોએ શનિવારે આસમાની રંગના કપડાનો ઉપયોગ વધુ કરવો.
- નીલમ અથવા તેના ઉપરત્નોને વીંટીમાં ધારણ કરવું.
- શનિ ગ્રહથી સંબંધિત વસ્ત્રોનું શનિવારે દાન કરવું.
- શનિ ગ્રહ પીડા નિવારક શનિ યંત્ર ઘરમાં લગાવી તેની સામે શનિ સ્ત્રોતનું જાપ કરવું.

- મીન રાશિ-

- આ રાશિના વ્યક્તિએ દરરોજ શનિ ગ્રહના તાંત્રિક મંત્રનું પાઠ કરવું.
- ઘરની બહાર કાળા ફૂતરાને રોટલી ખવડાવી.
- મહામૃત્યુંજય મંત્રનું દરરોજ જાપ કરવું.
- દરરોજ શિવલિંગની પૂજા કરવી. પારદના શિવલિંગ ઘરમાં સ્થાપિત કરવાથી શનિ કષ્ટોથી છુટકારો મળે છે.
- પીપળાને જળ અર્પણ કરવું.